

August 21, 2020

National Stock Exchange of India Limited
"Exchange Plaza"
Bandra – Kurla Complex,
Bandra (E), Mumbai – 400 051
NSE Code: GHCL

BSE Limited
Corporate Relationship Department,
1st Floor, New Trading Ring, Rotunda Building,
P.J. Towers,
Dalal Street, Fort, Mumbai – 400 001
BSE Code: 500171

Dear Sir / Madam,

Sub: Filing of Published copy of Advertisement released for transfer of equity shares to IEPF

Pursuant to requirement of Listing Regulations read with other applicable provisions, if any, please find enclosed herewith copy of advertisement released in The Hindu - Business Line (English) dated August 19, 2020, The Economics Times (English) - Ahmedabad edition August 19, 2020, and The Economics Times (Gujarati) dated August 19, 2020.

You are requested to kindly take note of the same and please also take suitable action for dissemination of this information.

Thanking you

Yours faithfully

For GHCL Limited

Bhwneshwar Mishra
Sr. General Manager & Company Secretary

and hence there is no need to regulate their supplies. We see no reason to issue an order and direct the respondents to extend the bid validity dated 13th March, 2020 or to include masks and sanitizers as essential commodities under the Essential Commodities Act, 1955," Chief Justice Ramesh Lal said in the judgment. The GST on alcohol-based sanitizers is currently 18%. The rate of tax cannot be challenged in a court of law unless...

Act in March after the COVID outbreak. The notification was in force till June 30.

INVITATION TO OFFER FOR SHORT TERM LOAN

FCI intends to raise Rs. 25000 crore with green shoe option (the borrowing through STL will not exceed Rs. 75000 crore at any point of time) through Short Term Loan from Scheduled Bank for 3 month maturity. For more detail, visit <https://eprocure.gov.in/eprocure/app> and <https://fci.gov.in/tender.php>. The last date of submission of offer is 29.08.2020 till 06:55 PM.

Chief General Manager (Funds)
Telefax No.-011-43527312

Option 2: 4 numbers of 2 MW each
The second hand natural gas set should not be more than 10 years old.

Factory Address:
Saint-Gobain India Pvt. Ltd.
Plot No. A-1, SIPCOT Industrial Park, Sriperumbudur - 602 105, Dist. Kancheepuram, Tamil Nadu.

Interested parties can submit their offers along with all the technical details, company profile by e-mail to sunilkumar.p@saint-gobain.com and tapas.padhi@saint-gobain.com on or before 9th September, 2020.

For any clarification you can contact:
Mr. Sunil Kumar Panda +91 96683 26086 / Mr. Tapas R Padhi +91 80031 94210

11. Last date for Submission of Claims	16 th September 2020
--	---------------------------------

Notice is hereby given that the National Company Law Tribunal (Mumbai Bench) has ordered the commencement of liquidation of EMI Transmission Limited on 14th August 2020 (copy of the order received on 17th August 2020).
The stakeholders of EMI Transmission Limited are hereby called upon to submit their claims with proof on or before 16th September 2020, to the liquidator at the address mentioned against item No. 10.
The financial creditors shall submit their proof of claims by electronic means only. All other stakeholders may submit the proof of claims in person, by post or by electronic means.
Submission of false or misleading proofs of claim shall attract penalties.

Sd/-
Shailesh Desai
IBBI/PA-001/IP-P00183/2017-18/10362
Liquidator for EMI Transmission Ltd

Date: 16th August 2020
Place - Mumbai

STATE BANK OF INDIA
Ahmedabad Circle, Local Head Office, Lal Darwaja, Bhadra, Ahmedabad-380001.

MANAGEMENT OF RETIRED OFFICERS (MMGS-III & ABOVE) SBI/e-ABS OF SBI ON CONTRACT BASIS FOR THE POST OF DIRECTOR, SBI FLC SOCIETY IN AHMEDABAD CIRCLE

Applications are invited for the post of Director, SBI FLC Society from Retired Officers (MMGS-III & above) of SBI/e-ABS of SBI, retired on attaining superannuation at the age 60 years and maintaining good health.
Application, eligibility criteria, terms and conditions, etc. will be available at SBI site at <https://bank.sbi/web/home/announcements>.
Applications completed in all respects should reach us on or before 24.08.2020.
Date: 18.08.2020
Sd/ Assistant General Manager (HR)

**Government of Punjab
Department of Finance
Directorate of Public Enterprises & Disinvestment
Vite Yojna Bhawan, 4th Floor, Plot No. 2B, Sector 33 A,
Chandigarh
Telephone 0172-2660063**

ADVERTISEMENT

Global invitation for Expression of Interest for strategic disinvestment of 71.20% shareholding in Punjab Communications Ltd. ("PUNCOM" or company") by Government of Punjab.

PUNCOM is a Public Sector Enterprises under the administrative control of the Board of Directors of the company. Established in 1981, PUNCOM was promoted by Government of Punjab (GoP) through Punjab Information & Communication Technology Corporation Ltd. (PICTCL) with 100% equity participation. At present GoP holds 71.20% (71.12% through Punjab Information & Communication Technology Corporation Ltd. and 0.08% through PSIDC) of paid up equity share capital of the Company.

The Company is having its registered office at - B-91, Phase VIII, Industrial Area, SAS Nagar (Mohali), Punjab-160071. The Company ISO 9001:2015 certified and has state-of-the-art manufacturing facility spread over 1,90,000 sq. feet in SAS Nagar, Mohali.

The Company is a leading manufacturer and supplier of telecommunication equipment and IT solutions in India. Its product range covers voice/data multiplexers, Power Line Carrier Communication (PLCC), DC Power Plants and associated services. It caters to the growing telecommunication needs of major organizations in the country including Indian railways, power sector private railway/power sector contractors, corporates etc.

The Government of Punjab ("GoP") has granted in-principle approval to disinvest 100% of its equity shareholding in PUNCOM (which is equivalent to 71.20% of the total paid up equity share capital of PUNCOM) through Strategic Disinvestment with transfer of management control ("Strategic Disinvestment" or "Transaction").

The GoP, through the DPED has appointed Resurgent India Limited ("Resurgent" or "Transaction Advisor") as its advisor to advise and manage the Transaction.

Expression of Interest (EOI) is invited from Interested Bidders having minimum net worth of Rs. 75.00 crores as on 31.03.2019. The complete invitation of EOI document along with Preliminary Information Memorandum ("PIM") can be viewed / downloaded from www.resurgentindia.com, www.puncom.com, www.punjabinfotech.gov.in and www.pbindustries.gov.in

EOI shall be submitted physically by the Interested Bidder on or before 03.10.2020 (at 1100 hours IST) ("EOI Due Date") at the address mentioned below. Please note that the GoP and the Transaction Advisor reserve the right to accept or reject all or any of the EOIs without communicating any reason whatsoever.

Akhilesh Raina, Associate Vice President
Resurgent India Limited
903-906, 9th Floor, Tower-C, Unitech Business Zone, Sector-50, Nirvana Country, Gurugram-122018, Haryana.

Interested Bidders may note that PUNCOM being a listed company is governed by Securities and Exchange Board of India (Substantial Acquisition of Shares and Takeovers) Regulations, 2011. In case any Interested Bidder(s) chooses to make an open offer under SEBI regulations, GoP reserves the right to accept or reject such open offer without communicating any reason whatsoever.

DPR/Pb.: 1/64947/2020

GHCL LIMITED (CIN : L24100GJ1983PLC006513)
Regd. Off.: GHCL House, Opp. Punjabi Hall, Navrangpura, Ahmedabad-380009. (Gujarat) Ph. 079-39324100
Fax: 079-26423623 Email: ghclinfo@ghcl.co.in, secretarial@ghcl.co.in Website: www.ghcl.co.in

NOTICE - (FOR THE ATTENTION OF EQUITY SHAREHOLDERS OF THE COMPANY)

SUB.: MANDATORY TRANSFER OF EQUITY SHARES OF THE COMPANY TO INVESTOR EDUCATION AND PROTECTION FUND (IEPF)

Notice is hereby given to the Shareholders of the Company pursuant to the provisions of Section 124(6) of the Companies Act, 2013 read with Investor Education and Protection Fund Authority (Accounting, Audit, Transfer and Refund) Rules, 2016 ("the Rules") that the Company is required to transfer the shares in respect of which dividend remains unpaid or unclaimed for a period of seven consecutive years, to the IEPF Account established by the Central Government. Hence, all the underlying Equity Shares in respect of which dividend has not been paid or claimed for last seven consecutive years from the financial year 2012-13, have to be transferred to the IEPF Authority as per said Rules.

As per the said Rules, the Company had sent a communication dated August 8, 2020 to the concerned shareholders individually at their latest available address, who did not claim the Dividends for seven consecutive years starting from financial year 2012-13 and whose shares were liable to be transferred to IEPF, requesting them to claim the same. The Company had also uploaded the details of the shareholders whose shares were liable to be transferred to IEPF on its website viz., www.ghcl.co.in.

In this connection, please note the following;

- In case of shares held in physical form** : Duplicate share certificate(s) will be issued and transferred to the Demat Account of the IEPF Authority. The original share certificate(s) registered in your name and held by you will stand automatically cancelled and be deemed non-negotiable.
- In case of shares held in electronic form** : The shares shall be debited to your demat account and will be transferred to IEPF's demat account.

Notice is hereby further given that in absence of receipt of a valid claim by the shareholders till September 26, 2020, the Company is in process of transferring the said shares to IEPF Account without further notice in accordance with the requirement of said Rules.

Please note that no claim shall lie against the Company in respect of the unclaimed Dividend amount and shares transferred to IEPF pursuant to the said Rules. On transfer of the Dividend and the shares to IEPF, the Shareholders may claim the same by making an application to IEPF in Form IEPF-5 as per the IEPF Rules. The said form is available on the Company's website and website of IEPF viz., www.iepf.gov.in.

In case the shareholders have any queries on the subject matter and the Rules, they may contact to the Company (E-mail : secretarial@ghcl.co.in) or to the Company's Registrar and Share Transfer Agents, M/s. Link Intime India Pvt. Ltd., Unit - GHCL Limited, C-101, 247 Park, L.B.S. Marg, Vikhroli (West), Mumbai-400083. Phone : +91-022-49186270; Fax : +91-022-49186060; E-Mail : iepf.shares@linkintime.co.in

Place : Noida
Date : August 18, 2020

For GHCL Limited
Sd/- Bhuwneishwar Mishra
Sr. General Manager & Company Secretary

SALE NOTICE

Advance Surfactants India Limited - In Liquidation

E-Auction of Business as a Whole & On Going Concern Basis Under the Insolvency and Bankruptcy Code, 2016

Date & Time of E-Auction: Friday, 25th September 2020 from 11 am to 5 pm (With unlimited extension of 10 minutes)

E-Auction Sale of Business as a Whole & on Going Concern Basis of M/s Advance Surfactants India Limited - In Liquidation on "As is where is basis", "As is what is basis", "Whatever there is basis", and "No recourse basis".

Nature of Asset	Description	Reserve Price (INR)	Earnest Money Deposit (INR)	Incremental Bid Amount (INR)
Business of All the Units of Corporate Debtor comprising of Land, Building, P&M, other assets etc	The Corporate Debtor comprising of All the Units of All Locations located at Silvassa, Puducherry, Hooghly, Mangalore and Pithampur (MP) as a Going Concern. (Description of Assets, Properties etc owned by the Corporate Debtor at all the Locations provided in E-Auction Process Information Document and may be downloaded from the link provided below)	Rs. 20,00,00,000/- (Rupees Twenty Crores only)	Rs. 1,00,00,000/- (Rupees One Crore only)	Rs. 10,00,000 (Rupees Ten Lakhs only)

Terms and Conditions of the E-Auction:

- The complete E- Auction Process Information Document containing Terms and Conditions of E- Auction are available on website of approved service provider M/s Right2vote Infotech Private Limited - <https://right2vote.in> and also on www.kgsip.com For any clarifications Contact Mr. K G Somani, E-Mail: kgsomani.advance@gmail.com
- The Liquidator has the absolute right to accept or reject any or all offer(s) or adjourn/postpone/cancel the e- Auction or withdraw any property or portion thereof from the auction proceeding at any stage without assigning any reason thereof.

Sd/-
Kishan Gopal Somani - Liquidator
IBBI Reg No: IBBI/PA-001/IP-P00300/2017-18/10544
KG Somani Insolvency Professionals Private Limited
Address: 3/15, 4th Floor, Asaf Ali Road, New Delhi - 110002
Email id kgsomani.advance@gmail.com, Contact Number: 011-41426262, 011-23277677

રહશે અને પાસ ધારકન બં ટાકટ મળશે. કર્મચારીઓને આઈઆરસીટીસી વેબસાઈટ પરથી ટીકટ બહુ કરાવવામાં કોઈ પ્રકારનો ચાર્જ આપવો નહીં પડે. ઈ-પાસની મદદથી કર્મચારીઓ અનારક્ષિત ટીકટ પણ ખરીદી શકશે. ગેઝેટેડ અધિકારીઓને એક વર્ષમાં છ અને નિવૃત્ત થયા પછી ૩ પાસ મળે છે. આ પાસ અંતર્ગત તેઓ અને તેમના પરિવાર નિઃશુલ્ક મુસાફરી કરી શકશે.

ત્રાજા ૯૫૨૯૨ પદાવવાના પાપ વચ્ચે હતા. દિલ્હીમાં લીટરે ૧૬ પૈસા, મુંબઈમાં લીટરે ૧૪ પૈસા, ચેન્નાઈમાં લીટરે ૧૨ પૈસા અને કોલકાતામાં લીટરે ૧૩ પૈસા ભાવ વધ્યા હતા. જો કે આજે સતત ૧૭મે દિવસે ડિઝલના ભાવ સ્થિર રહ્યા હતા.

ઈન્ડિયન ઓઈલની વેબસાઈટ પર જણાવાયા મુજબ દિલ્હી, કોલકાતા, મુંબઈ અને ચેન્નાઈમાં પેટ્રોલના ભાવ અનુક્રમે વધીને રૂપિયા ૮૦.૮૦, રૂ. ૮૨.૪૩, રૂ. ૮૭.૫૮ અને રૂ. ૮૩.૮૯ થઈ ગયા હતા. બજારના જાણકારોના કહેવા મુજબ ચીને અમેરિકાનું કાચું તેલ ખરીદવાની પ્રક્રિયા શરૂ કરી હોવાથી આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા કૂડ તેલના ભાવમાં તેજ આવી હતી.

બેન્ચમાર્કર કાચું તેલ બેન્ટુ કૂડના ભાવ આંતરરાષ્ટ્રીય બજારમાં બેરલ દીઠ ૪૬ ડોલર થઈ જતાં ભાવ ઊંચકાયા હતા..

રાખેલ છે. બી-૧૦૨, ન્યુ જશપાક સોસા. ઈસનપુર, વટવા રોડ, અમદાવાદ.

નામ બદલેલ છે

મારુ જુનું નામ હરીશ માધવદાસ બરવાણીથી બદલી નવું નામ હરીશકુમાર માધવદાસ પારવાણી રાખેલ છે. ૧૧, રાધાસ્વામી સોસાયટી, કુબેરનગર, અમદાવાદ.

ANNOUNCEMENT
I, ASHOK KUMAR DROLIA DO HEREBY IRREVOCABLY, UNCONDITIONALLY AND IRREVERSIBLY DECLARE AND STATE THAT I HAD DISOWNED AND DISINHERITED MY SON ASHISH DROLIA FROM ALL MY RIGHTS.

(ઉપર) જાહેરનામા મુજબ પાસ ધારકના પાપ વચ્ચે હતા. દિલ્હીમાં લીટરે ૧૬ પૈસા, મુંબઈમાં લીટરે ૧૪ પૈસા, ચેન્નાઈમાં લીટરે ૧૨ પૈસા અને કોલકાતામાં લીટરે ૧૩ પૈસા ભાવ વધ્યા હતા. જો કે આજે સતત ૧૭મે દિવસે ડિઝલના ભાવ સ્થિર રહ્યા હતા. ઈન્ડિયન ઓઈલની વેબસાઈટ પર જણાવાયા મુજબ દિલ્હી, કોલકાતા, મુંબઈ અને ચેન્નાઈમાં પેટ્રોલના ભાવ અનુક્રમે વધીને રૂપિયા ૮૦.૮૦, રૂ. ૮૨.૪૩, રૂ. ૮૭.૫૮ અને રૂ. ૮૩.૮૯ થઈ ગયા હતા. બજારના જાણકારોના કહેવા મુજબ ચીને અમેરિકાનું કાચું તેલ ખરીદવાની પ્રક્રિયા શરૂ કરી હોવાથી આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા કૂડ તેલના ભાવમાં તેજ આવી હતી. બેન્ચમાર્કર કાચું તેલ બેન્ટુ કૂડના ભાવ આંતરરાષ્ટ્રીય બજારમાં બેરલ દીઠ ૪૬ ડોલર થઈ જતાં ભાવ ઊંચકાયા હતા..

ફોન: ૭૯૯૨૨ મંડળના કુશ્મળા દ્વારા ટેન્ની કમ્પ લિમિટેડ માટે ફોન: ૭૯૯૨૨ મંડળના કુશ્મળા દ્વારા ટેન્ની કમ્પ લિમિટેડ માટે સહી: / મુબુબ પરીખ ટેન્ની સેક્રેટરી અને કોમ્પ્લાયન્સ અધિકારી

નેકોની યાદીમાં મુકેશ રાહી છઠ્ઠા સ્થાને પહોંચ્યા

ઘટાડો થયો છે. તેમની સંપત્તિ ૭૮.૮ અબજ ડોલર છે. આ યાદીમાં ચોથા સ્થાન પર ટેલ્વા અને સ્પેસ-એક્સના સીઈઓ એલન મસ્ક આવી ગયા છે. તેમની કુલ સંપત્તિ ૮૪.૮ અબજ ડોલરની છે.



ગુએચસીએલ લિમિટેડ

રજી. ઓફીસ : ગુએચસીએલ હાઉસ, પંજાબી હોલ સામે, નવરંગપુરા, અમદાવાદ-૩૮૦૦૦૬.(ગુજરાત)
Ph. 079-39324100 Fax: 079-26423623 Email: ghclinfo@ghcl.co.in, secretarial@ghcl.co.in
Website: www.ghcl.co.in (CIN : L24100GJ1983PLC0066513)

કંપનીના ઇક્વિટી શેરધારકોને ધ્યાન દોરવા અંગેની નોટીસ

બાબત : કંપનીના ઇક્વિટી શેર ઇન્વેસ્ટર એજ્યુકેશન એન્ડ પ્રોટેક્શન ફંડમાં (આઈઈપીએફ) ફરજિયાત તબદીલ કરવા
આથી આ કંપનીની શેરધારકોને નોટીસ આપી જણાવવાનું કે કંપની કાયદો ૨૦૧૩, ની કલમ ૧૨૪(૭) ની જોગવાઈ અનુસાર અને ઇન્વેસ્ટર એજ્યુકેશન એન્ડ પ્રોટેક્શન ફંડ ઓથોરીટી (એકાઉન્ટીંગ, ઓડીટ, ટ્રાન્સફર અને રીફંડ) રૂલ્સ, ૨૦૧૩ (ધ રૂલ્સ) સાથે વાંચતા તેમાં દર્શાવેલ જોગવાઈ અનુસાર કંપનીએ જે શેરધારકોએ સતત સાત કે તેથી વધુ વર્ષો સુધી કિવિડન્ડની રકમ જમા લીધી નથી કે તેના ઉપર ઘણો કરેલ નથી તેઓના બદલાયે શેરો કેન્સર સરકાર દ્વારા સ્થાપિત આઈઈપીએફ એકાઉન્ટ ખાતે તબદીલ કરવાના રહેશે. આથી ઉપરોક્ત રૂલ્સની જોગવાઈઓ અનુસાર કંપની દ્વારા એવા શેરધારકો કે જેમણે નાણાકીય વર્ષ ૨૦૧૨-૧૩ થી લઈને સતત સાત કે તેથી વધુ વર્ષો સુધી કિવિડન્ડની રકમ જમા લીધી નથી કે તેના ઉપર ઘણો કરેલ નથી તેમના શેર આઈઈપીએફ ઓથોરીટી ખાતે તબદીલ કરેલ છે.

ઉપરોક્ત રૂલ્સ મુજબ કંપની દ્વારા લાગતા વળગતા બધા શેરધારકોને તા. ૨૮મી ઓગષ્ટ, ૨૦૨૦ વ્યાક્ટિગત રીતે તેમના ઉક્ષા પ્રાંસ સરનામા ઉપર ધન વ્યવહાર કરેલ અને નાણાકીય વર્ષ ૨૦૧૨-૧૩ થી શરૂ કરીને સતત સાત વર્ષ સુધી કિવિડન્ડનો ઘણો કરેલ નથી કરવાનો શેરધારકો કે જેમના શેરો આઈઈપીએફ ખાતે તબદીલ થયાને લાચક હતા તેમને આવા શેરો માટે ઘણો કરવા વિનંતી કરેલ હતી. કંપની દ્વારા ટેકે શેરધારકો કે જેમના શેરોને આઈઈપીએફ ખાતે તબદીલ કરવાના છે તે ટેકે શેરધારકો અને તેમના શેરોની વિગતો પણ કંપનીની વેબસાઈટ www.ghcl.co.in ઉપર અપલોડ કરેલ છે.

આના સંદર્ભમાં, નીચેની વિગતો ધ્યાનમાં લેવા વિનંતિ
અ. જો શેરો નોટીસ સ્વરૂપમાં ઘાસક કરેલ હોય તો : ડુપ્લિકેટ શેર સર્ટિફિકેટ જારી કરવામાં આવશે અને આઈઈપીએફ ઓથોરીટીના ડીમેટ એકાઉન્ટ ખાતે તબદીલ કરવામાં આવશે. આપના દ્વારા નોંધાયેલ અને આપે ઘાસક કરેલ ઓરીજનલ શેર સર્ટિફિકેટ ઓથોરીટીને કીડી રદ ગણાશે અને તે નોન-વ્યવહારુ માની લેવાશે.

બ. જો શેરો ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં ઘાસક કરેલ હોય તો : આ શેરો આપના ડીમેટ એકાઉન્ટમાંથી કીડી કરવામાં આવશે અને તે આઈઈપીએફ ઓથોરીટીના ડીમેટ એકાઉન્ટ ખાતે તબદીલ કરવામાં આવશે.

આથી વધુમાં નોટીસ આપી જણાવવાનું કે શેરધારકો દ્વારા તા. ૨૬મી સપ્ટેમ્બર, ૨૦૨૦ સુધીમાં માન્ય ઘણાની પ્રાપ્તિના અભાવથી કંપની દ્વારા ઉપરોક્ત રૂલ્સની જરૂરીયાતની પૂર્તતા માટે આવા શેરોને વધુ કોઈ નોટીસ આપ્યા વગર આઈઈપીએફ એકાઉન્ટ ખાતે તબદીલ કરવાની પ્રક્રિયા શરૂ કરાશે. એની નોંધ લેશો કે ઘણો કરેલ નથી કરવામાં આવેલ કિવિડન્ડની રકમના સંદર્ભમાં કંપની સામે કોઈ ઘણો કરી શકાશે નહીં અને ઉપરોક્ત રૂલ્સ મુજબ આ શેરોને આઈઈપીએફ ખાતે તબદીલ કરવામાં આવશે. શેર અને તેનું કિવિડન્ડ આઈઈપીએફ ખાતે તબદીલ થયા પછી જો કોઈ શેરધારક તેનો ઘણો કરવો હોય તો આઈઈપીએફ રૂલ્સ માં જણાવ્યા મુજબ ફોર્મ નં. IEPF-5 માં આઈઈપીએફ ને અરજી કરવી. આ ફોર્મ કંપનીની વેબસાઈટ અને આઈઈપીએફ ની વેબસાઈટ www.iepf.gov.in ઉપર પણ ઉપલબ્ધ છે.

શેરધારકોને ઉપરોક્ત બાબત અને તેના રૂલ્સ અંગે કોઈપણ જાતની સમસ્યા હોય તો તે કંપનીના E-mail : secretarial@ghcl.co.in ઉપર સંપર્ક કરે અથવા કંપનીના રજીસ્ટ્રાર અને ટ્રાન્સફર એજન્ટનો સંપર્ક કરો. એ. લિંક ઈન્ટરબેંક ઈન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ, ચુનિટ ગુએચસીએલ લિમિટેડ, સી-૧૦૧, ૨૪૭ પાર્ક, એલબીએસ માર્ગ, વિખોલી (પશ્ચિમ), મુંબઈ- ૪૦૦ ૦૮૩. Phone : +91-22-49186270, Fax : +91-22-49186060, E-Mail : iepf.shares@linkintime.co.in

રચણ : નોઈડા તારીખ : ૧૮મી ઓગષ્ટ, ૨૦૨૦

ધી. વાંચ (મહિલા) દૂધ ઉત્પાદક સહકારી મંડળી લિ. મું. વાંચ, તા. દસ્ક્રોઈ, જિ. અમદાવાદ.
અમારી સંસ્થાનું નોંધણીનું પ્રમાણ પત્ર જેનો રજી.નં.: સે.દૂ. ૨૪૧૪૮ ખોવાયેલ છે. જે કોઈને મળે તો ઉપરોક્ત સરનામે જાણ કરવા વિનંતી. - ચેરમેન

જાહેર નિવિદા નં.૦૭ સને ૨૦૨૦-૨૦૨૧
ગુજરાત રાજ્યના રાજ્યપાલ વતી કુલ: ૦૧ (એક) કામ અંદાજીત રકમ રૂ. ૧૫.૧૭ લાખના કામ માટે યોગ્ય શ્રેણીમાં નોંધાયેલ ઈજારદારશ્રીઓ પાસેથી કાર્યપાલક ઈજનેરશ્રી, નવરંગપુરા (માXમ) વિભાગ, જ-એ, બહુમાળી ભવન, ડ્રાઇવ ઈન રોડ, વજાપુર, અમદાવાદ-૩૮૦૦૫૨ દ્વારા ઓન લાઇન ટેન્ડર માંગવામાં આવે છે. ટેન્ડર દસ્તાવેજો અમારી વેબસાઈટ www.mnb.nprocure.com ઉપરથી તા. ૧૮-૦૮-૨૦૨૦ થી ૦૨-૦૯-૨૦૨૦ ના રોજ ૧૮.૦૦ કલાક સુધી જોઈ અપલોડ કરવાના રહેશે. શક્ય હશે તો આ કામના ટેન્ડરો તા. ૦૩-૦૯-૨૦૨૦ ના રોજ સમય ૧૨.૦૦ કલાકે વિભાગીય કચેરીએ ટેન્ડર ખોલવામાં આવશે. બાનાની રકમની એફ.ડી. આર.ડી. તથા ટેન્ડર-ફીનો ડીમાન્ડ ડ્રાફ્ટ નેશનલાઈઝ બેન્ક / શિલ્ડયુલ બેંકનો કાર્યપાલક ઈજનેર, નવરંગપુરા (માXમ) વિભાગ, અમદાવાદના નામનો બિડાણ કરવાનો રહે છે. વધારાની માહિતી અને ઓન લાઇન ટેન્ડર ભરવા માટે અમારી ઉપર ઘણવિલ વેબસાઈટ જોવા વિનંતી છે તથા માહિતી ખાતાની વેબસાઈટ www.statenders.com પર જોવા મળશે. ક્રમાંક/સમાનિ/અમદ/૪૮૨/૨૦૨૦